

મહાકાલની વક્તવ્ય સમજો

દંડના નહીં ઈનામના પાત્ર બનો



સાહસે આપણાને સાદ પાડયો છે. સમયે, ચુગના કર્તવ્યે, જવાબદારીએ, વિવેકે, પૌર્ણે, આપણાને સાદ પાડયો છે. આ સાદને પોકારને વણસાંભળ્યો કેમ કરી શકાશે? આત્મનિર્માણ માટે નવનિર્માણ માટે કાંટાથી ભરેલા માર્ગનું, અમે સ્વાગત કરીશું અને આગળ વધીશું, લોકો શું કહે છે? અને શું કરે છે? એની ચિનતા કોણ કરે? માર્ગદર્શન માટે પોતાનો આત્મા જ પૂરતો છે. લોકો અંધારામાં ભટકે છે, ભટકતા રહેલા અમે, પોતાના વિવેકરૂપી પ્રકાશના સહારે, જાતે જ આગળ વધીશું, કોણ વિરોધ કરે છે અને કોણ સમર્થન, એની ગણત્રી કોણ કરે? પોતાનું સાહસ અને પોતાનો અંતરાત્મા પોતાની સાથે જ છે. સત્યને માટે, ધર્મને માટે, ન્યાયને માટે, અમે એકાંકી આગળ વધીશું અને એ જ કરીશું, જે કરવાનું, અમારા જેવા અડગા જાગૃત વ્યક્તિત્વવાળાઓ માટે, ઉચિત અને ઉપયુક્ત છે.

પરિવર્તન માટે સમર્થની, સાહસની અપેક્ષા રાખવામાં આવે છે. સંસારમાંથી સાહસ સમાખ થઈ ગયું. યૌવનની ઉમંગોને ભીડાંતા ગળી ગઈ, એ કલંકથી અમોને કલંકિત નહીં થવા દઈએ. બીજા કોઈ નહીં તો છેવટે અમે એકલા જ આગળ વધીશું, વધી રહ્યા છીએ અને ત્યાં સુધી વધતા રહીશું કે જ્યાં સુધી, હાલની અવાંછનીય પરિસ્થિતિઓ, મુશ્કેલીઓ અને વિચારણાઓનો અંત નહીં આવે. ચુગને બદલવો જ છે, એટલે પોતાના જ દૃષ્ટિકોણ અને કિયાકલાપનું પરિવર્તન, સાહસ કે દુસ્સાહસ પૂર્વક કરવું જ પડશે. એ સિવાય અન્ય કોઈ જ માર્ગ નથી.

અમે ચુગના પોકારનો વારંવાર ઉદ્ઘોષ કરીએ છીએ, ઉચિત છે કે સમયસર ચુગના પોકારને સાંભળવામાં આવે, નહીં સાંભળવામાં આવે તો, વધારે તો અમે શું કહીએ માત્ર ચેતવણી જ આપીએ છીએ કે ભવિષ્યના થોડા જ દિવસોમા, મહાકાલ પ્રતિભાઓને વ્યક્તિત્વ સ્વાર્થના બંધનોમાંથી મુક્ત કરાવી લેશો, કોઈ ધનવાન મનમાન્યો ખોટોખર્ય નહીં કરી શકે, કોઈનીય બુદ્ધિ વ્યક્તિત્વ વૃષ્ણાની પૂર્તિમાં નહીં વપરાય, કોઈનુંચ બળ વાસનાની પૂર્તિમાં સંલગ્ન નહીં રહેવા દેવાય.

નોંધ કરવાવાળા નોંધ કરી લે, જેને આજે અમે સ્વેચ્છા, સજ્જનતાપૂર્વક અનુદાનના રૂપમાં માંગીએ છીએ. અગાર લોકોથી એ આપવાનું નહીં બને તો, એ દિવસોય હવે દૂર નથી કે પ્રત્યેક કુમાર્ગમાંથી આ દૈવી વિભૂતિઓને, મહાકાલ લાત મારીને, આંચકી લેશો અને ત્યારે, લાંબા સમય સુધી વેદનાથી કણસતા રહેવાનું દર્દ સહન કરવું પડશે. આજે આ ત્યાગ, ઉદારતા, આત્મસંતોષ અને ઐતિહાસિક યશની સાથે જ કરવાનો અવસર છે.

ભવિષ્યના ગ્રીસ વર્ષોની અંદર, સંસારમાં એકપણ વ્યક્તિ અમીર નહીં રહે. પેસા વહેચાઈ જશે. પૂંજુ પર સમાજનું નિયંત્રણ રહેશે અને લોકો ફક્ત પોતાના નિર્વાહ માટે જ અર્થસાધન મેળવી શકશે. બુદ્ધના અનુયાયીઓએ, ત્યાગની હવા ફેલાવી તો, લાખો ચુવક ચુવતીઓ યૌવન અને ધૈભવનું સુખ છોડીને, પરમાર્થ પ્રયોજન માટે ભિક્ષુ, ભિક્ષુણીનું, કષ્ટમય જીવન જીવવા માટે તૈયાર થઈ ગયા. ગાંધીની આંધી શરૂ થઈ તો, જરૂરી કાર્યો અને રંગીન સ્વપ્રાંને પગ નીચે કચરી નાખીને, લાખો મનસ્થીઓ જેલ ચાતનાઓ અને ફાંસી, તેમજ ગોળીઓ ખાવા માટે ચાલી નીકળ્યા. એ સમયે ભલે લોકોએ એમને મૂર્જ ગણ્યા હોય. પરંતુ ઈતિહાસ સાક્ષી છે કે એમનો એ નિર્ણય એમના માટે સૌભાગ્ય અને સુયશનનું દ્વારા ખોલનાર બની ગયો. એ લોકો ધન્ય બની ગયા.

હાલ પણ મહાકાલ પ્રતિભાશાળીઓને ચુગ નેતૃત્વ માટે, સાદ પાડી રહેલ છે. સુયોગ સૌભાગ્યનો, અનુપમ અવસર સામેજ છે-વાસના, વૃષ્ણા અને અહૃતાના કુચકને તોડીને, જે યોદ્ધા સર્જન સૈનિકો આગળ વધશે, તેઓ જરૂર દિવ્ય અનુદાનોના ભાગીદાર બનશે જ. જે સ્વાર્થને, વળગી રહેવાનો પ્રયાસ કરશે તો તે બમણું નુકશાન ઉઠાવશે જ. મહાકાલ, એ કુચકને, પોતાના ભીષણ જોરદાર પ્રણારથી તોડશે. કુચક સાથે વળગી રહેનારા પર શું વિતશે? કદાચ એનું અનુમાન અત્યારે કોઈપણ નહીં કરી શકે.

સારા માણસો વિવેકની વાતનો સ્વીકાર કરે, ભયંકર પશ્ચાતાપ અને પીડાથી બચો, તેમજ અનુપમ સૌભાગ્ય, સુયશના ભાગીદાર બને.